

ફેબ્રુઆરી 1, 2018

બ્રામ્પટનમાં કળા અને સંસ્કૃતિનું ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા (INspiration) અને સહભાગિતા (INput) ની શોધમાં

બ્રામ્પટન, ઓન્ટેરિયો: ફેબ્રુઆરી 1 નાં રોજ, સીટી ઓફ બ્રામ્પટને બ્રામ્પટનની પહેલી સંસ્કૃતિ માસ્ટર યોજનાના વિકાસ માટે વિશાળ જનતાને પ્રવૃત્તમય કરવાની વ્યૂહરચનાના ભાગ તરીકે ઓનલાઇન મોજણી (સર્વે) રજૂ કર્યો, કળા અને સંસ્કૃતિ માટે સમુદાય-ચલિત દૃષ્ટિકોણ જે આગામી દસ વર્ષો માટે મ્યુનિસિપલ સાંસ્કૃતિક સેવાઓ અને રોકાણના વિતરણને માર્ગદર્શન આપશે.

સમગ્ર ફેબ્રુઆરી અને માર્ચ 2018 દરમિયાન પ્રવૃત્તમય રહેવાની 70 કરતા વધારે તકો હોવાની સાથે, આ શહેર બ્રામ્પટનમાં કળા અને સંસ્કૃતિ પર સમુદાયના પરિપ્રેક્ષ્યોને પકડી પાડવા, તેમજ ભવિષ્ય માટે મૂલ્યો અને પ્રેરણાઓને શોધવા કટિબદ્ધ છે. સહભાગિતા માટેની અન્ય તકોમાં પડોશમાં અને શહેરભરના પ્રસંગોમાં ભાગીદાર વર્કશોપ્સ અને પોપ-અપ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ માસ્ટર યોજનામાં સામેલ થવાની રીતને લગતી વિગતો વેબસાઇટ પર જોઈ શકાય છે, www.brampton.ca/culturemasterplan.

સ્પીયરહેડિંગ ઍંગેજમેન્ટ (અગ્રગામી પ્રવૃત્તિ) એ લોર્ડ ક્લ્યરલ રિસોર્સીસ અને નોર્ડીસીટીની ઔદ્યોગિક-આગેવાન ટીમ છે, જેઓને શહેર દ્વારા પાનખર ઋતુ 2017 માં યોજનાના વિકાસને એક નિષ્ણાત માર્ગદર્શન આપવા રોકવામાં આવ્યા હતા, અને તે જૂન 2018 માં પૂરી થશે. સાંસ્કૃતિક વિકાસ માટે વ્યૂહાત્મક દિશા પૂરી પાડવા ઉપરાંત, આ યોજના નવીનતમ, સંયોજિત અને ગતિશીલ વૈશ્વિક શહેર બનવા માટે શહેરના વ્યાપક આયોજન દૃષ્ટિકોણનો મહત્વનો ભાગ છે.

અવતરણો (ક્વોટ્સ):

કળા અને સંસ્કૃતિથી નોકરીઓ ઊભી થાય છે, અર્થતંત્રો ચાલે છે અને તે ઓન્ટેરિયોમાં \$28.5 બિલિયનનો ઉદ્યોગ છે. બ્રામ્પટનમાં આપણી આસપાસ રોમાંચક તકો રહેલી છે. હું આપણાં તમામ રહેવાસીઓને આપણી પહેલી સંસ્કૃતિ માસ્ટર યોજનાની રચના અને સહાયતામાં સામેલ અને સહભાગી થવા પ્રોત્સાહિત કરું છું. સાથે મળીને ચાલો આપણે હિંમતવાન બનીએ અને બ્રામ્પટનમાં કળા અને સંસ્કૃતિ માટે પ્રેરણામય સામુહિક ભવિષ્ય બનાવીએ!

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

સંસ્કૃતિ માસ્ટર યોજના એક મહાન શહેર બનાવવા, કળા અને સંસ્કૃતિ ચલાવવાની અને તેમાં રોકાણ કરવાની રીતો પુનઃરચવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે. જાહેર સામેલગીરી એ ખાતરી કરાવવા માટે સટીક હોય છે કે આ યોજના સમુદાયની આગેવાનીમાં, અજોડ અને રોમાંચક બની રહે. બ્રામ્પટન આપણાં સમુદાયનો બાંધો બનતી પ્રચંડ રચનાત્મક પ્રતિભાઓ અને સંસાધનો બનાવીને ઓન્ટેરિયોમાં એક સાંસ્કૃતિક નિર્ધારિત લક્ષ્ય બનવા બેઠું છે.

- બોબ ડાર્લિંગ (Bob Darling), ડાયરેક્ટર, ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ક્લ્યર (આર્થિક વિકાસ અને સંસ્કૃતિ)

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

બ્રાયન સ્ટિટલ (Brian Stittle)

સીનિયર મીડિયા કોર્ડિનેટર (Sr. Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.2143 | brian.stittle@brampton.ca